



**PE-007-1016006**

Seat No. \_\_\_\_\_

**B. Sc. (Home Sci.) (Sem. VI) (CBCS) (W.E.F. 2016)**

**Examination**

**March / April - 2020**

**Gen. Home Science : Paper - 6**

**(Food Preservation & Fancy Cookery) (New Course)**

**Faculty Code : 007**

**Subject Code : 1016006**

Time : 2 Hours]

[Total Marks : 50

- |   |  |    |
|---|--|----|
| 1 | બેક્ટેરીયોસ્ટેટીક પદ્ધતિ વિશે લખો.     | 10 |
|   | અથવા                                   |    |
| 1 | અથાણાનાં પ્રકારો વિશે લખો.             | 10 |
| 2 | જેલી વિશે સવિસ્તર સમજાવો.              | 10 |
|   | અથવા                                   |    |
| 2 | કોફી વિશે સવિસ્તર સમજાવો.              | 10 |
| 3 | સમજાવો - એરેટેડ પીણાઓ (સોફ્ટ ડ્રીંક્સ) | 10 |
|   | અથવા                                   |    |
| 3 | સમજાવો - કોઈપણ ચાર કુકિંગ મટીરીયલ્સ    | 10 |
| 4 | સમજાવો - ખાદ્ય પરિરક્ષણનાં સિદ્ધાંતો   | 10 |
|   | અથવા                                   |    |
| 4 | સમજાવો - ખાદ્યપદાર્થ રાંધવાનાં હેતુઓ   | 10 |
| 5 | ટૂંકનોંધ લખો. (કોઈપણ બે)               | 10 |
|   | (૧) મર્મિલેડ                           |    |
|   | (૨) ચા                                 |    |
|   | (૩) બેક્ટેરીયા દ્વારા ખોરાકનો બગાડ     |    |
|   | (૪) ફળરસ                               |    |

PE-007-1016006 ]

[ Conted...

## **ENGLISH VERSION**

- |           |  |           |
|-----------|--|-----------|
| <b>1</b>  | Write about Bacteriostatic method.         | <b>10</b> |
| <b>OR</b> |  |           |
| <b>1</b>  | Write about Types of pickles.              | <b>10</b> |
| <b>2</b>  | Explain in details about Jelly.            | <b>10</b> |
| <b>OR</b> |  |           |
| <b>2</b>  | Explain in details about Coffee.           | <b>10</b> |
| <b>3</b>  | Explain - Aerated Beverages (Soft drinks). | <b>10</b> |
| <b>OR</b> |  |           |
| <b>3</b>  | Explain any four cooking materials.        | <b>10</b> |
| <b>4</b>  | Explain - Principle of food preservation.  | <b>10</b> |
| <b>OR</b> |  |           |
| <b>4</b>  | Aims and objectives of cooking foods.      | <b>10</b> |
| <b>5</b>  | Write Short notes (Any two)                | <b>10</b> |
|           | (1) Marmalade.                             |           |
|           | (2) Tea.                                   |           |
|           | (3) Food spoilage by Bacteria.             |           |
|           | (4) Fruit Juice.                           |           |
-